

ત્વરિત જાહેરાત માટે

## ડાઉનટાઉન બ્રેમ્પટન ખાતેના ગાર્ડન સ્ક્વેરમાં NBAની ફાઇનલ મેચનું જીવંત પ્રસારણ

બ્રેમ્પટન, ઓન્ટારિયો (29 મે 2019) – ટોરોન્ટો રેપ્ટર્સની NBAની ફાઇનલમાં ઐતિહાસિક આગેકુચને – જે આજદિન સુધીમાં આ સિદ્ધિ મેળવનાર કેનેડાની સહુ પ્રથમ ટીમ છે – તેને ઉજવવા સીટી ઓફ બ્રેમ્પટન ડાઉનટાઉન બ્રેમ્પટન ખાતેના ગાર્ડન સ્ક્વેરમાં તમામ ફાઇનલ ગેમ્સનું જીવંત પર્સારણ કરવામાં ગૌરવની લાગણી અનુભવે છે.

ગાર્ડન સ્ક્વેર દ્વારા ટોરોન્ટો રેપ્ટર્સ અને હાલનાં ચેમ્પિયનો ગોલ્ડન સ્ટેટ વોરિયર્સ વચ્ચે થનાર મેચની સિરિઝ બહાર રાખવામાં આવનાર મોટા સ્ક્રીન પર પ્રસારિત કરવાના સર્વ હક્કો મળવી ચુક્યું છે જે ગુરૂવારે, મે 30ના રોજ રાત્રે 9 વાગ્યે શરૂ થશે.

ચાહકોને પોતાની ખુરશીઓ અને બ્લેકેટો સાથે લાવીને અત્યંત રોમાંચિત બનવાની સંભાવના ધરાવતી સિરિઝ માટે તૈયાર રહેવા આહવાન આપવામાં આવે છે જેમાં રેપ્ટર સ્ટાર કાવલી લિઓનાર્ડ અને વોરિયરના સ્ટાર સિટવન કરી વચ્ચે મુકાબલો થશે.

ગાર્ડન સ્ક્વેર જે ડાઉનટાઉન બ્રેમ્પટનમાં કિવન અને મેઈન સ્ટ્રીટનાં ખુણે સ્થિત છે તેમાં ગમ્મતભર્યા વિવિધ પ્રોગ્રામિંગ, ઈવેન્ટ્સ થશે જેમાં આખા વર્ષ દરમિયાન તમામ વયના લોકો માટેનું મનોરંજન હશે.

અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca/gardensquare](http://www.brampton.ca/gardensquare)

### અવતરણ

"કેનેડા માટે આ એક રોમાંચક સમય છે અને અમને આવી ઊર્જા બ્રેમ્પટન ખાતે લાવતા ગૌરવની લાગણી થાય છે. GTAના તમામ વિસ્તારોના નિવાસીઓ સાથે મળી અહીં આવીને ટોરોન્ટો રેપ્ટર્સને અહીં જ આપણા ડાઉનટાઉન બ્રેમ્પટનના હાર્દ સમા ગાર્ડન સ્ક્વેરમાં અમારા 100 ફુટના સ્ક્રીન પર ચિઅર કરી શકશે."

- મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**मिडिया संपर्क:**

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया ऐन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूडात्मक संवाद

सीटी ओफ् ब्रॅम्पटन

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)